શ્રી

છુત છાત

અનુવાદક અને પ્રસિદ્ધકર્તા

મોહમદ ખુમ નકશબંદી

એડીટર નૂરે ઇસ્લામ

[illegible]—અમદાવાદ

પ્રથમ આવૃત્તિ [illegible]   [illegible]

સન ૧૯૨૪   હિજરી [illegible]

અમદાવાદ [illegible]

ધી મનહર [illegible]

મોતીલાલ ગણપતરામે [illegible]

કીમત ચાર આના   આફ્રિકા માટે [illegible] પેન્સ

અર્પણ પત્રિકા.

મા૦ માનવતા મુરબ્બી,

અતિ વ્હાલા શિર છત્ર પુજ્ય પિતાશ્રી

મૌલાના હાજી મૌલવી શમશુદ્દીન ઉર્ફે હાજીમીયાં બીન મૌલાના હાજી મૌલવી મોહમ્મદમીયા નકશબંદી.

આપ પિતાશ્રીએ તાબેદારને કેળવણી જેવા અમૂલ્ય ફળ ચખાડી આપની નસુરણ ફરજ અદા કરી છે અને હજી પણ પોતાના અમુલ્ય વખતની વસીયત ક્ષણે ક્ષણે આપી રહ્યા છો તે ઉપરાંત આપ દીને મોહમ્મદીની ભારી લાગણી ખરા દિલથી ધરાવો છો વળી આપ અરબી, ફારસી મહાન ગ્રંથોના ઊંડા અભ્યાસી હોઈ તેના આધારે તમામ લોકોને ફાયદો પહોંચાડવાને આપ સદા તત્પર રહ્યા છો આપની ઝળકતી કારકિર્દીની માનભરી યાદમાં આ નાનકડું પુસ્તક માન ભરાયલ ફરજની સેવની લાગણી સાથે આપને અર્પણ કરૂં છું

હું છું આપનો અદના પુત્ર

મોહમદ ખ્રમ

તમહીદ.

ખુદાની તારીફ અને તેના બરગુઝીદા રસુલપર દુરૂદ પઢીને મારા મુસલમાન ભાઇઓને લાભ અને તરક્કીનો ભેદ ખુલ્લો કરી સમજાવવાની ગરજથી અદબ સાથે અરજ કરૂ છુ, કે મારૂ લખાણ અમરતેતસરમા "કુત છાત" નામની ચોપડી પ્રગટ થએલીનુ અનુવાદ છે, અને ઇસલામી ભાઇ-ભાઇઓને ધધા રોજગારમા મદદ કરી હરેક પ્રકારે લાભ આપીને બીજી કોમમા પૈસો બરબાદ થતા અટકાવવાના હેતુથી છે, તેને ધ્યાનમા લેશો વળી ગુજરાતના મુસલમાન કોમનો ઘણો ભાગ ઉર્દુ પઢી શકતો નથી, અને ઉર્દુ ભાષા ગુજરાતી અક્ષરોમા લખેલી હોય તો, પણ ઘણી વાર સમજણ નથી પડતી, બલકે ખોટી મતલબ થઈ પડે છે કેમકે ગુજરાતી અક્ષરોમા ઉર્દુ ભાષા બરાબર નથી લખાતી, વળી મારો હેતુ એક આમ રીતે પબ્લિકનો ધ્યાન ખેચવાનો છે, માટે ગુજરાતી ઉર્દુ આમેજ ભાષામા અનુવાદ કરૂ છુ મારા લખાણમા ભુલચુક હોય તો દરગુજર ફરમાવી ખરી મતલબ ખ્યાલમા લેવા અરજ છે

લી ખાદિમ

મોહમદખુબ નકશબંદી

સુઇગરાની પોળ **અમદાવાદ.**

૫

મુસલિમ.

ઓ મુસલિમે બેદાર જહાંકોભી જગાદે,
જો આગ તેરે દીલ મે હે હર દીલમેં લગાદે
ફીર નકશએ તવહીદ ઝમાને કો દિખાદે,
બુત ખાનેમેં અસનામ કી તસવીર મિટાદે
હે દેખ ઝિયા સુબહે હિદાયત કી નુમાવા,
એક બાગસે સોતી હુઈ બસ્તી કો જગાદે,
ભટકે હુએ લોગો કો રહે રાસ્ત દિખાકર,
દીવાના ખમે ઝુલ્ફે પયબર કા બતાદે
ગમ શઓકમે તુ વિર્દ જુબા અલ્લાહો અલ્લાહ,
હર કલબપે ઇસનામકા એક સિક્કા બિઠાદે.
આલમકો દિખા જલવએ અખલાકે પયબર
ઓર અહદે અબુબકરો ઉમર યાદ દિલાદે
હર તાલિબે મવલાકો ખુમિસ્તાને અલીસે,
એક જામે લબાલબ મએ ઇશ્કકા પિલાદે,
કુચ્છ ખઓફ નકર યઆસિમોક લ્લાહો મિનન્નાસ,
બન્દોકો ખુદાવન્દ કે અહકામ સુનાદે,
ફિર પહન બિરાહીમ કે ઇસલામકા જામા,

ઓર આતિશે નમરૂદ કે શોઅલોકો ખુનક
તવહીદે ઈલાહીકી દીએચલ તુ મુનાદી,
તવફીકે અમલ તુજકો જહાંતકકે ખુદા દે
દરકાર નહી ખંજરે ફૂવલાદ કે જવહર,
તલવારકો મત રંગે ખુસુમતમે જિલાદે,
તવહીદે રિસાલત કે દલાએલકો બયાં કર
બાતિલકો મિટા ઓર હકીકતકો અયાં કર,



છુતછાત.

છુતછાત એટલે શુ! અમે કોઈ માણસને પોતાની પાસે બેસવા દઈએ નહિ, અગર બેસે તો તેને ઉઠાવી મુકીએ અને પોતાની સાથે મળીને ખાના પીના દઈએ નહિ એવા દુર રહેવાને હીંદુઓ છુત કહે છે એ શબ્દનો ખરો અર્થ તો હિંદુઓનો રીવાજ છે જેમકે હિંદુ ઔરતો સુવાવડ અને હેજના દીવસોમા ઘણુ કરીને છુતની બાબત પાબંદી કરે છે, જયા સુધી હેજનો અસર અને નીફાસનો નીશાન રહે છે, તે વખત સુધી ખાના પીવાની તમાન ચીજો અને પહેરવા ઓઢવાના તમામ લુગડા લત્તાથી દુર રહે છે શી તાકાત કે કોઈ એને હાથ પણ લગાડી શકે! છેટે બેસીને દહાડા ગુજારે છે અને સુઈ પણ જુદીજ રહે છે ખાના પીવાના વાસણો જુદા કરી દેવાય છે, આ વખતે તે ઓરત જાણે તદન નાપાક ગણાય છે આવી હાલતમા જે ચીજ તેને અડે તે પણ તદનજ નાપાક થઈ જાય છે એવીજ રીતે જ્યારે કોઈ હિંદુ મરી જાય છે, ગમે તો તે ઓરત હોય કે મરદ ઘરડો હોય કે જુવાન ત્યારે તેના તમામ નજીકના સગાવહાલા ક્રિયા કરમ સુધી આમરીતે બેસવા ઉઠવા અને ખાવા પીવાથી જુદા કરી દેવાય છે, હશે હમારે તો આ ઠેકાણે તેવી જાતની છુતાછાતથી કામ નથી અમે તો તે મનહુસ છુત વિષે લખીશું

કે જે અમે મસ્લેગ્ઇ મુસલમાનોની સાથે વર્તવામા આવે છે, જેથી અમને અનહદ નુકસાન પહોચી રહ્યા છે

અમારી છુતછાત—છુતછાતનુ બયાન અમે આ લખાણમા કરવા ધારીએ છીએ, એ વ્યાજબી છે કે તેનો કોઈ દાખલો ખુલાસાની ગરજથી અરજ કરી શકીએ કે તેના આવ્હા લખાણથી હરેક માણસ જેને અલ્લાહતઆલાએ ઈન્સાની હમદર્દી અને મજહબી અથવા અખલાકી ગયરતમાથી સારો ભાગ ઈનાયત કરેલો છે, તે પોતાની બનતી કોશીશે પોતાની આબરૂ અને ધન દોલત સભાળવાની કોઈ વ્યાજબી રીત કરી શકે

ઘણી વખત આપને હિંદુ દુકાનદારો પાસેથી કાઈ ખરીદવાનો વખત મળ્યો હશે એ લોકો જયારે કોઈ મુસલમાન સાથે આપ લે કરે છે, તો ખાવા પીવાની ચીજોમાથી જેમકે મીઠાઈ, દુધ, દહી શરબત, શીરો વગેરે ચીજો મુસલમાન ઘરાકના હાથ સુધી સાવચેતીથી પહોચાડવામા આવે છે. પહેલા તો બિચારા મુસલમાનને દુર રહેવાની હીદાયત થાય છે, તેમા એ વાતનો જરા પણ ખીયાલ રાખવામા નથી આવતો કે તે મુસલમાન કયા દરજ્જાનો છે ઈજ્જત આબરૂનો પણ ખીયાલ નથી હોતો, અથવા ચોખા સાફ હોવાને પણ નથી ગણતા ફકત મુસલમાન હોવુજ તે બચારાને માટે બસ છે, જયારે તે એ આબરૂ ઢેઢ ચમારની પેઠે દુર

રહીન પઈસા આપે છે તો તે પઈસા પણ ઘણુ કરીને હાથના નથી લેવાતા કાઈ ચીજપર લેવાય છે સખત ખીયાલ ગણવામા આવે છે કે આપવા લેવામા મુસલમાનનો હાથ કયાએ અડી જાય નહિ પઈસા લીધા પછી ગમે તેવી સારી નહારી ચીજ વ્યાજબી લાગ્યુ તો તોલ કરીને દુરથી ફેકી દીધી કોઈ વખત તો વાગી અને નકામી હોવાને લીધે તે ચીજો વ્યર્થ ફેકી દેવામા આવે છે એ વર્તણુકમા મુસલમાન ચમાર ઢેઢ અને કુતરા વગેરે નાપાક જાનવરો બરાબર છે

વાગી અથવા સડેલી ચીજ જો કદી પાછી આપવા ચાહે તો તે નથી આપી શકતા એટલા માટે ફેકી દેવી પડે છે

કેટલાક હિંદુ દેવતાએ એવા કામને માટ કોઈ લોઢાની કડછી અથવા વાસણો વિગેરે ખાસ કરી રાખેલા છે અને તે-માજ માગેલી ચીજ પણ મુકીને ઉપરથી નાખે છે એક યુરોપી દોસ્તે પોતાના એક પુસ્તકમા લખ્યુ છે કે મે એક વઈદને પોતની આખે જોયુ છે કે તે, ઝલીલ કોમની નાડી પણ લોઢાના ચીપીઆથી મુલાહેજા ફરમાવતા હતા, એ સઘળુ એટલાજ માટે થાય છે કે કોઈ મલેચ્છ હયા ફરોશ મુસલમાનનુ લુગડુ અથવા શરીરનો કોઈ ભાગ હિંદુ મહાત્માને અડી જાય નહિ,

કદી એમ પણ જોવામા આવ્યુ છે કે કોઇ સુફેદ પોશાક ચોખો આબરૂદાર નેક બખત મુસલમાન કોઇ હિંદુની દુકાને બેસેલો હોય અને તેવામા જો કદી તે હિંદુ દુકાનદારની ગેટલી પાણી અથવા દમડીની કે પઇસાની ખાવાનીજ આવી જાય તો પછી તે મુસલમાનની સઘળી આબરૂ પાણી કરવામા કશુ બાકી રાખતુ નથી, પહિલા તો એવી કોશીશ કરવામા આવ છે કે તે મલેચ્છ મુસલમાન ને દુકાન પરથી ઉતારીને પાણીનો ઘુંટ ભરવો અથવા દમડીના પકોડા ખાવામા આવે અને જો કદી કોઇ અક્કલના આંધળા પણ ગાડના પુરા મુસલમાનથી કાઇ મતલબ કે આશા છે, તો પછી પેલા હિંદુ મહાત્માઓ પોતાની તબીયતને મજબુર કરીને દુકાનથી ઉતરીને પાણી પીલે છે, ને પછી પોતાના કામમા લાગી જાય છે

હિંદુ ઓરતોને પણ કેટલીક વાર બજારમા ચાલતા ફરતા જોયુ હશે તે ભાયડાઓ કરતા વળી વધારે સાવચેતીનો ખીયાલ રાખે છે, ને એટલે સુધી કે બજારમા ચાલી જતી હોય તો પોતાના બાળકો બચ્ચાઓને મુસલમાનોથી બચવા અને અડવાની ડગલે ડગલે મનાઈ કરતી જાય છે, અને જો કદી કોઇ નાના મોટા મુસલમાનને અડી ગયુ, તો પછી તેની બચારાની મોકાણ એકડો ગાળો તે બાળકને અને લાખો કરોડો ગાળો તે મુસલમાનને સંભળાવીને દીલ ઠંડુ કરવામા આવે છે

શીખામણ લેવા લાયક દાખલો—એક વાર એક હિંદુ ઓરતે પોતાના નાની વયના બચ્ચાને ખાવા માટે બીસકુટ આપ્યા તે એ સમજ બચ્ચું તે બીસકુટ લઈને ઘરમાંથી બહાર ગયું એવામાં એક કુતરો ત્યાં આવ્યો બનવાકાળ તે બચ્ચાના હાથમાંથી બીસકુટ જમીનપર પડી ગ, એટલે તે કુતરો ઉપાડીને ચાલતો થયો બચ્ચું તો શોર બકોર કરવા લાગ્યું કે મારી કુતરો બીસકુટ લઇ ગયો, બ ચારી માયાના લીધે બીસકુટ બીસકુટ કરતી નાસતા જતા કુતરા પાછળ દોડી. ઓરતની બેચેની દેખીને એક મુસલમાન બચ્ચાને દયા આવી એટલે તરતજ કુતરાની પછાડી જઈને બીસકુટ છોડાવ્યું હમણાં જમીન પર પડયું નહોતું કે ઓરતે શોર બકોર કરવા માંડયો કે છોકરા બીસકુટને અડીશ નહિ મુસલમાન છોકરાએ હાથનો લગાડયો નહિ પણ કહેવા લાગ્યો કે કુતરાના મોડાથી નાપાક ન થયો તે શું મારા અડવાથી બગડ થઇ જશે ! ઓરત બોલી કે હા છોકરા અમારો હિંદુ ધર્મ ઘણો કાચો છે અમે લોકો ઢેડ ચમાર અને મુસલમાનના હાથનો નથી ખાઈ શકતા આથી અમારો ધર્મ ખરાબ થઇજાય છે, કુતરા બલાડાના અડવાથી તો દોશ પ્રાપ્ત થતો નથી, કેમકે એ જનાવરો હરવખતે અમારા ઘરમાં આવતા જતા રહે છે, એઓથી છુતાછાત ગણીએ તો અમારૂં જીવવું મુશકેલ છે વળી એક

બીજી વાત પણ છે કે જેના લીધે અમે લોકો તેનાથી છુતછાત એટલી બધી નથી ગણતા

અમારા ધર્મના પુસ્તકોમા લખ્યુ છે, કે જે લોકો ખોટા કામ કરે છે તે મનુષ્ય જીવન છોડીને પશુ જીવનમા ચાલ્યા જાય છે ઈશ્વર જાણે આ કુતરા બીલાડા જે દર-બદર માર્યા માર્યા ફરે છે તે કોણ છે? કોણ જાણે કે કોઈ વેળાએ એ લોકો ક્ષત્રી, પંડિત બ્રાહ્મણ અથવા અમાર માબાપ બેનભાઈ હોય, છોકરા અમને આ પશુઓથી વિચાર કરવાની અમને કશીપણ હીદાયત નથી વણ હા મલેચ્છો (મુસલમાન) થી બચવા અને તેમના હાથ લાગેલી ચીજો ખાવાની સખત મનાઈ સુણતા આવ્યા છીએ છોકરો આવી નવાઈ ભરેલી વાતો શરમથી સાભળીને ચાલતો થયો જેવી રીતે સારી અને લાભકારક રીતરીવાજથી બે સમજ અને નનાદાન માણસો નુકસાન ઉઠાવે છે અને તકલીફો સહન કરે છે બીલકુલ તેવીજ રીતે કોઇ વખત નાશાએસતા અને ખરાબ રીતરીવાજથી કેટલાક નસીબદાર અને નેક ફીતરત માણસો લાભ ઉઠાવે છે અને ફાયદો લે છે છુત છાત રીવાજ એમા શક નથી કે માણસ જાતીને માટે એક બે હદ શરમ ભરેલો અને નાશકારક છે પણ એક પંજાબી દોસ્ત લખે છે કે ખુદાના સોગન છે એજ ખરાબ રીવાજે પાક ઈસ્લામનો મને રસ્તો દેખાડયો છે-

તે પંજાબી દોસ્ત લખે છે કે હું જ્યારે શુજાઆબાદ ના જીલ્લામા ખેંગપુરની ગવરમેંટ સ્કુલમા હતો ત્યારનો એક બનાવ મને સારી પેઠે યાદ છે કે હું પોતાની ક્લાસના છોકરાઓ સાથે રવીવારના દીવસે આદત પ્રમાણે ખેલતો હતો છોકરાઓમા હિંદુઓ પણ હતા, અને મુસલમાનો પણ હતા એક મુસલમાન છોકરાના હાથમા વાંસડી હતી કે જેના ડાગણથી રેશમી ફુમતાવાળી સોય મોઢેથી ફુંકવાથી બીજાને જઇ લાગતી હતી સોય ચુભવાથી તેને તકલીફ થતી તેણે વાંસડીમા સોય નાખી કે તરતજ મે જલદીથી બીજે છેડેથી ફુંક મારીને તે સોય પાછી મારી દીધી, મે તે વાંસડીને મોઢું લગાડયું હતું કે મારા બીજા સાથી છોકરાઓએ તરતજ શોર મચાવી દીધો કે રામચંદ્ર ભ્રષ્ટ થઇ ગયો, થતા થતા તે ખબર મારા માબાપને પહોચી એટલે હું જ્યારે ઘેર ગયો ત્યારે મારી માએ અંદર આવવા દીધો નહિ એટલામા મારા બાપા પણ આવ્યા અને તેજ વખતે પંડિત હેમરાજ સાહેબની પાસે લઇ ગયા પંડિત સાહેબને તમામ વાતથી વાકેફ કર્યા, તે પંડિત સાહેબ તમામ વાત સાંભળીને નીચે પ્રમાણે કહેવા લાગ્યા

પંડિતજી—રામચંદ્ર ! સાંભળો, તમે જે કામ કર્યો છે તે બહુજ ખોટો છે હવે પછી એવું ન કરવા વચન આપો એટલે હું તમને શુદ્ધ (ચોખ્ખા) કરાવી દઉં જે હવે પછી

કોઈ મુસલમાનની એઠેલી ચીજને મોઢું લગાડશો તો પછી ગંગા જવું પડશે આ વખતે પંચગુરભી અથવા પંદર દિવસના વ્રત (રોજા) રાખવાથી તમે શુદ્ધ થઈ શકો છો તમે પંચગુરભી પીશો કે પંદર દીવસના વ્રત રાખશો !

હું—મહારાજ ! હું પંચગુરભી પીવાને તયાર છું પંદર દિવસ વ્રત રાખી શકીશ નહિ કેમકે સખત ગરમીના દિવસો છે એ તો ફરમાવો કે પંચગરભી કોને કહે છે !

પંડિતજી—ગંગાજળ, દહીં ગાયનો ગોબર અને ગાયનો મુત્ર અને પતાસા એ પાંચ ચીજોને મેળવીને પંચગરભી કહે છે એનો એક ગલાસ પીલો અને ચાલ્યા જાઓ, પણ હવે પછી એવું કરશો નહિ

હું—પંડિતજી મહારાજ ! હું સખત તાજુબીમાં છું કે બહારની બાજુ કુંક મારવાથી તો હું અશુદ્ધ (નાપાક) થઈ ગયો, અને આવી ગલીચ નાપાક ચીજો પીવાથી કેવી રીતે શુદ્ધ થઈ જઈશ? એથી તો એજ સારૂ છે કે હું પંદર દીવસ વ્રત (રોજા) રાખું

પછી પંડીતજી સાહેબે મને ઉલટું સીધું સમજાવ્યું પણ મને સમજ પડી નહિ છેવટે હું વ્રત (રોજા) રાખવાને તયાર થઈ ગયો એટલે માબાપે મને પુરા પંદર દીવસ સુધી પોતાના ખાણપાનથી દુર રાખ્યો પણ મારા

દિલમા એ વાતચીતે એવી કોઈ બેચેની પેદા કરી દીધી, કે સત્યતા અને અસત્યતા કયા ધર્મમા છે ! તે તજવીજ કરતા અને એ વાત મને ઘણી નવાઈ ભરેલી જણાઈ કે એક સાધારણ વાત કે જેનાથી કોઈ જાતનો નુકશાન નથી છતા નાપાક બતાવવામા આવે છે અને ગોબર અને ગાયનો મુત્ર એવા પાક સમજવામા આવે છે, કે તેનાથી નાપાકી દુર કરવાને માટે માણસને બવગાવવાની ફરજ પાડવામા આવે છે એ તજવીજમા તો પડયો, પણ તેનુ પરિણામ એ આવ્યુ કે હુ એકલોજ નહિ બલકે મારી સાથે ઘણા સ્વદેશી હિંદુ ભાઈઓ હિંદુ ધર્મને તજી દઈને ખુદાની ઈનાયતથી હવે મુસલમાન છે અલહમ્દો લીલ્લાહે અલા જાલીક

એવી જાતના બીજા હજારો દાખલા છે, કે જે હમેશ બજારમા આપ જોતા હશો એટલા માટે હવે વધારે બયાન કરવાની જરૂર નથી

દરખાના અગર કસ્અસ્ત યકહરફ બઅસ્ત

છુતછાતનીશરૂઆત—ખરી રીતે કોઈ પણ કહી નથી શકતો કે હિંદુસ્તાનના હિન્દુઓમા છુતછાતનો રીવાજ મુસલમાનોના આવવા પહેલા મવજુદ હતો અથવા મુશલમાનોના આવવાથી એ રીવાજ થયો અથવા કોઈ ઇત્તિહાસ પરથી પણ નથી માલુમ પડયુ કે એ રીવાજની શરૂઆત કેવી રીતે હિન્દુઓમા થઈ છે ! અક્કલ બેશક એમ જણાવી

શકે છે, કે જ્યારે હિન્દુસ્તાન બીજી કોમથી ખાલી હતો એમ મુસલમાનો આબાદ નહોતા અને પારસી, યાહુદી, ઈસાઈ વગેરે વેદોની મુનકીર કોમનુ નામ નીશાન પણ નહતુ ત્યારે મીરાસી કુંજડા નાચનાર ગાનાર પણ એજ કોમનાજ હશે, અને ઢેડ, ચમાર, મોચી, હજામ વીગેરે નીચ કોમ પણ એમાથીજ હશે એજ કારણ છે કે વેદમા કેટલાક નીચ કોમનુ પણ વર્ણન મવજુદ છે જ્યારે એકજ જાતી હશે ત્યારે ખીયાલ કરી શકાય છે કે તે વખતે તેમનામા કુતછાત જરા પણ હશે નહિ, આ વખતે દુનીયામા આવા કેટલાક નસીબદાર શહેરો મવજુદ છે કે જયાની તમામ પ્રજા એકજ કોમ એકજ ધર્મને માનનારી છે એકજ ધર્મનો એક સપુત અદાલતના તખતને શોભાવી રહ્યો છે પણ બીજો કમનસીબ કપુત કોઈ શરીફ અથવા નેક માણુસની હજામત કરવામા કે લુગડા ધોવામા ગુથાયેલો છે ત્રીજો વળી ઝાડુ દેવામા સતોષ માનીને ખાનદાનની બદનામીનુ કારણ બનેલો દેખાય છે જેને એવો સીન જોવો હોય તો તે જરા અફઘાનીસ્તાન, તુરકસ્તાન, અરબ, મીસર, ફ્રાન્સ, ઇગલાડ, અમેરીકા વગેરે મુલકો ફરીને જુએ એટલે ત્યાના લોકોના માહોમાહેના હેવાલો આ લખાણની મુજબ ખરા જણાઈ આવશે

આપ એમ પણ માની લેશો કે મુસલમાનોના આવવા પહેલા હિન્દુ લોકોમા દરેક પ્રકારના હુન્નરવાળા માણુસો

જરૂર હશે તો પછી એમ થઈ શકતુ નથી કે બ્રાહ્મણ વિદ્યા (ઇલ્મ) પણ ભણતો હોય પુજાપાઠ પણ કરતો હોય ખેતીવાડી પણ પોતેજ કરતો હોય, પોતાના લુગડા પણ પોતેજ ધોતો હોય, પોતાના જોડા પણ પોતેજ શીવતો હોય ઝાડુ વાળતો હોય પાણી ભરતો હોય અને દરેક કામમા હુન્નર ધધામાં બીજા કોઈનો મોહતાજ ન હોય, તે જમાનો તો લાખો વરસ થયા પોતાનુ સીન દેખાડીને ગુજરી ગયો આવા સુધારાવાળા ફેશનદાર વખતમા આવી જાતનો ખીયાલ કરવો પણ અશકત જણાય છે એટલા માટે એજ મત કાયમ થઈ શકે છે કે જ્યારે હિન્દુસ્તાનમા રાજાથી પ્રજા સુધી એકજ ધર્મ પાળનાર હશે તો જરૂરી છે કે તમામ નીચ કોમો પણ એમાથીજ હશે

જેવી રીતે ઉપલી વાતનો ખરાપણાને કોઇ પણ દાખવાની જરૂર નથી તેવી રીતે એ વાત પણ ખરીજ મનાશે, કે મુસલમાનો જયારે હિન્દુસ્તાનમા દાખલ થયા છે ત્યારે બહુજ રોબ દાબ અને દબદબાની સાથે દાખલ થયા છે એમના એમના એક હાથમા તો મુકદ્દસ ઇસલામની પાક કીતાબ હતી અને બીજા હાથમા ફ્નેહ અને નેકબખતીનો વાવટો ફરકતો હતો, એ વાત માનવા લાયક નથી અને સમજમા પણ નથી આવતી, અગર કોઇ ઇતિહાસપરથી પણ નથી જણાતુ કે હિન્દુસ્તાનમા મુસલમાનો

દાખલ થતી વખતે તેમની સાથે સ બ્યાબધ બહોળી મર્યાદામા કમીની કોમો પુણ દાખલ થઇ છે પણ એટલુ સમજાય છે, કે જયારે તે ભાગ્યવતોએ હિદુસ્તાનમા આવીને ઇસલામી રાજયનો પાયો જમાવ્યો ત્યારે તેમની ચાકરી કરવાને અને ફરમાન બજાવવાને માટે એજ હિદુ લોકોજ મુકરર થયા હશે, એજ મહાત્માઓ તે વિજયી કોમની તમામ જરૂરીયાતોના ગુલામીના હકો બજાવતા હશે એજ લોકો તેમના સાઇસ હશે, એજ લોકો તેમના જોડા ઉઠાવતા, લુગડા ધોતા અને ઝાડુ વાળતા વીગેરે કામોને પોતાની આબરૂ ઇજજતનુ કારણ માનતા હશે

મુસલમાનોની ધાર્મિક પવિત્રતા અને ઇસલામી દબદબાનો ખ્યાલ કરતા અમે એમ પણ માનીએ છીએ કે જયારે એ પવિત્ર જ્ઞાતીએ પોતાના તાબામા હિદુઓની જીદગી ગુજારવાની રીતભાત અને ધર્મનીતિને દેખી હશે ત્યારે જરૂરી છે કે તેમણે આવી અજ્ઞાન કોમ, મુર્તિપુજક, હઠધર્મ નાપાક તેહઝીબ વગરના અને નીમકહરામી કોમથી અલગ રહેવુ જરૂર પસદ કર્યું હશે

આજકાલ જોઇએ તો માલમ પડે છે કે હિદુસ્તાનમા સતેજ વિદ્યાની રોશનીના દરયા જારી છે જાહેલ કોમો તહઝીબના માર્ગપર બેખટકે દોડતી દેખાય છે જગલી કોમો વહેમ અને ખયાલપુજાના ચકરોમાથી નીકળીને પોતાને

વિદ્યા-જ્ઞાનના આભુષણથી ગોભાવી રહી છે, ત્યારે આ વખતે પણ એજ વેદોના પુજારીઓ જીહાલત અને ગુમરાહીના ખાડામા ઉંધા મોંડે પડેલા હાલસુધી નીશામાજ છે

જ્યારે એક ખુદાને માનના (મુસલમાનો હિન્દુસ્તાનમા પધાર્યા છે તે વખતે હિંદુઓની જે સ્થીતી હતી તેનો ખરો નકશો જોવો હોય તો મનુસ્મૃતિ જુવો વેદોના મજમુન પઢો શાસ્ત્રોની અનીતી ભરેલી કહાણીઓ અને શરમભરેલા કિસ્સાઓ વાંચી જુઓ તો આવી મુર્તિપુજક અને જાહેલ કોમનો ઠીક ઠીક હેવાલ જણાઈ આવશે

ટુંકમા જણાવવાનુ કે મુસલમાનોના આવવાની વખતે હિંદુઓની તમદ્દુની અને ધાર્મિક જીંદગી બહુજ ખરાબ, ભયાનક અને શીખામણ આપનારી હાલતમા હતી શરાબ નોશી, જીનાકારી, જુઆબાજીનો આમ રીવાજ હતો એક ખુદાપાકના બદલે તેત્રીસ કરોડ દેવતાઓની પુજા કરવામા આવતી દરીયા, પર્વતો, નદી, નાળા, પહાડ અને પશુઓના સીવાય લીંગ અને ભગ પુજાનો આમ દસ્તુર હતો એજ પ્રમાણે બીજી હજારો ખરાબીઓ હતી જેને જોઈને ખુદાને માનનાર અને શરમવાળા માણસોના દીલ કકડે કકડા થઈ જાય છે,

આવા અણગમો સીન જોઈને કેમ માની શકાય ? કે ઈસ્લામના જાનનિસાર ખાદીમોએ એવી જંગલી કોમથી

મેળાપ વધારવા અથવા બેસવુ ઉઠવુ પસંદ કર્યુ હોય વળી ઈસ્લામી ધર્મ તો એ પણ કહી રહ્યો છે, કે ખુદાના સીવાય બીજાને પુજનાર નાપાક છે (ઈન્નમલ મુશરેકુના નજસુન) તો કેમ બની શકે ! કે તેવા ઈસલામી ગુરાઓ, ઈશ્વરના વહાલાઓ. ખુદાના આમ હુકમથી ઉલટુ કરવાની હિંમત કરીને ખુદાના શત્રુઓ સાથે હળી મળી રહેવા પસંદ કરે

જે માણસને મારી વાતની સત્યતા જોવી હોય તો તે યારકંદ, બુખારા વીગેરે ઈસલામી શહેરોમા જઈને આ કોમનો હેવાલ પોતાની આંખે જોઈ લે,

યારકંદના મુસલમાનો હિંદુઓથી સખત છુતછાત રાખે છે, તે એટલે સુધી કે જે દીવસે વરસાદ થાય છે તે દીવસે તો હુકમથીજ કોઈ પણ હિંદુ બજારોમા ખુલાસી રીતે ચાલી ફરી શકતો નથી તે એટલા માટે કે કોઈ દીન દાર મુસલમાનના લુગડા નાપાક ના કરે

હા ! એવુ છે કે તે વખતના હિંદુઓમા પણ જાત પાતનો ભેદ એવોજ હશે કે જેવો આ વખત હિંદુઓમા માલમ પડે છે, અથવા તેવી રીતે જે મનોજી મહારાજે હીદાયત ફરમાવી છે વળી મે પણ આ વાત પહેલાજ અરજ કરી દીધી છે કે તે વખતના હિંદુઓમા પણ દરેક રીત રીવાજ અને દરેક જાતના લોકો હશે ગાનારાઓ, મીરાશી કંજર, હીજડા, ભંગી, મોચી, ચમાર વીગેરે નીચ કોમો

પણ એમાથી બહોળી મ બ્યામા આબાદ હશે અને એઓમા આજકાલની પેઠેજ ધર્મનુ જુદાપણુ જરૂર હશે નહિ તો વેદ મત્રોમા એવી નીચ કોમોનુ વર્ણન આવત નહિ

ફરી જ્યારે ઇસલામી નુર અને તેજ હિદના જુના અધકારને હઠાવવા લાગ્યુ, વેદોના ફદામા ફસેલા ગાટી ઉઘમાથી જાગીને ઇસ્લામી ધર્મની છાયાયા આવવા લાગ્યા, ત્યારે ઈસલામના પવિત્ર પા૦ **ઇન્ના અકરમાકુમ ઇનદશાહે અતક્કાકુમ** (તમારામાથી જે પરહેજગાર છે, તે ખુદા પાસે આબરૂદાર છે) પ્રમાણે અને **ઇન્ના મલ મોમેનુના ઈખ-વતુન** (બધા ઈમાનવાળાઓ એક બીજાના ભાઇ ભાઈ છે) ની રીતે જાતભેદ નાશ થયો હશે વ શ કે કર્મભેદ પણ નહી હોય એટલા માટે નીચ કામ કરનારી કોમો પણ પોતાના પુર્વજોના દેખાદેખી પોતાનુ જુનુ ધર્મ તજીને મુસલમાન થઇ ગયા હશે કેમકે કહેવત છે કે અન્નાસો **અલાદીનેમોલુકેહીમ** (માણસો પોતાના બાદશાહની રીતભાત સ્વીકારે છે) પણ તમે જાણો છો કે

(હરયકેરા બાહરેકારે સાખત દ) (મયલેઓરા દરદીલશ અ દાખત દ

એટલે દરેક માણસને જુદા જુદા કામો માટે બનાવ્યા છે તેની ઇચ્છા પણ તે કામ તરફજ દોરાય છે

તમામ કામ કરનારી કોમો મુસલમાન થઇ ગઈ, છતા પોતાના બાપદાદાના ધધા રોજગાર પર કાયમ રહી ગયા જે

કદી ઇસ્લામી બાદશાહો તરફથી એવા નવા મુસલમાનોના માટે વિદ્યાજ્ઞાન આપવાની કોઈ ખાસ વ્યવસ્થા કરવામા આવતી હોત, તો બની શકતુ હતુ કે એ લોકો પોતાના બીજા મુસલમાન ભાઇઓની પેઠે તહેઝીબન આભુષણથી શોભવા લાગતા, અને વિદ્યાજ્ઞાનના તત્વથી નસો દાગ થઇને પોતાના અનગીતભર્યા અને નીચ ધંધાઓથી દુર થાત પણ એ લોકો એવાજ હાલમા રહી ગયા, અને એવા લોકો પહેલાજ હિંદુઓમા શુદ્રના અણગમા નામથી ઓળખાતા હતા, વળી હવે મુસલમાન થવા બાદ તેઓને વધારે ખોટું લાગ્યુ એટલા માટે જુદાપણાની રીત વધારે મજબુત થઇ ગઈ, આ તરફ મુસલમાનોમા પણ એ ... અજ્ઞાનપણા અને નીચ પણાના લીધે પુરી રીતે ભળી શક્યા નહિ ઇસ્લામી ધર્મે તો જાતપાતના ભેદ અને ધંધારોજગારના ફરકને માટીમા મેળવ્યુજ હતુ કુરાનશરીફ **લાઅનસાબા બયન કુમુલ-યવમા વલાઅનતુમ તુસઅલુન.** કીયામતના દીવસે ખાનદાન પુછવામા નહિ આવે) કહીને પછી **જાતના** ભેદોની જડ ઉખાડી કાઢી અરબના હાદીએ ... અરબી કોમોને ઇસલામમા દાખલ થઇ જવા બાદ એકજ લડીમા પરોવ્યા હતા, પણ હિંદુઓની સોબતે અને આવા નવા મુસલમાનોની સ્વભાવી રોગે હિંદી મુસલમાનોને પણ પોતાની અસર કરી દીધી

આવી જાતના દાખલાઓ અમારી પાડોશી ઈસાઈ કોમમા પણ મળી શકે છે અમારા પ્રમાણે એ લોકો પણ છુતછાત અને બીજા બદીથી બચી રહ્યા છતા એમનામા પણ નીચ કોમો સાથે તેજ પ્રમાણે વર્તન થાય છે જે પ્રમાણે તેઓ હકદાર છે અને લાયક છે, એટલે સુધી કે દેશી ઇસાઇ કોઈ વફરીનો કાયમ મુકામ થઇ શકતો નથી અને કોઈ યુરોપીયન નરીક લેડી સાથે પરણી શકતો પણ નથી

હા એમ થઇ શકે છે કે એવા દેશી ઇસાઈ કે જેઓ આ વખતે ખાનદાની ન હોવાના કારણે અથવા નીચ કોમો સાથે સબંધ રાખવાના કારણે તુચ્છ નજરે દેખાય છે તે જો કદી પોતાની સ્થીતી સુધારીને અને પોતના બાલબચ્ચા ઓને વિદ્યાજ્ઞાન સારૂ આપે તો એના શક નથી કે તેઓ પણ કેટલાક વખત પછી પોતાની ઇચ્છા ફળીભુત પામી શકે એજ રીતે હજારો એવા નવા મુસલમાનો છે કે જેઓ પહેલા કમીની કોમ સાથે સબધ રાખતા હતા, પણ મુસલમાન થતાજ પોતાની હાલત સુધારવામા વિજયી નિવડયા આ કાયદો કુદરતનો છે કે જે લોકો પોતાની ગુજારેલી જીદગી અને હાલની સ્થીતીને વખોડીને ઈસ્લામમા ફકત એટલા માટેજ દાખલ થાય છે, કે દુન્યામા ખુદા સુધી પહોચતો રસ્તો કોઇ છે, તો તે ઈસ્લામજ છે અને દુન્યવી ઉનતીનુ કારણ પણ ફકત ઇસ્લામજ છે તો તે લોકો ઇસ્લામી

કાયદાઓના પાબંદ અને પોતાની આબીરતને સુધારવામા મશગુલ રહે છે પછી ખુદાતઆલા કોઇની પણ મહેનત નકામી કરતો નથી સાચુ છે કે

કર રીયાજત કે રીયાજત કા સીલા મીલતા હય;
બંદગી કરનેસે કહેતેહૈં ખુદા મીલતા હય.

જે લોકો હેવાનોની પેઠે દુન્યા જાલમા ખુશી રહવાના ટેવીના હોય છે, તે દુન્યાના નીચ ગને આખેરતમા જાહેર ખોટના આવાાત રહે છે

તકલીફ અને મુસીબત ઉઠાવ્યા વગર બનવાના મળી શકતા નથી કુરાન શરીફની એક એક આયતો છે, કે તેમા કોશીશ અને મહેનત કરવાનો હુકમ આપવામા આવ્યો છે ફરમાવ્યુ છે **વ અન લયસા લિલ ઇનસાને ઇલ્લા મા સઆ.** માણસને કોશીશના પરમાણમાજ મળે **ઇન અહ-સનતુમ અહસનતુમ લે અનફુસેકુમ વઇન અસાતુમ ફલહા.** (જો સારા કર્મ કરશો તો તમારા માટે અને નઠારા કર્મ કરશો તો તે પણ તમારાજ માટે થશે)

હિંદના મુસલમાનોમા જેટલી નીચ કામ કરનારી કોમો છે, તે બચારી બધી એક સરખી રીતે વેદોના બજરથી ઘાયલ છે નામનાજ મુસલમાન બનાથી ફકત હિંદુઓથી જુદા પડી ગયા છે, નહિ તો હાલ સુધી એમનામા કુફરની રીતભાત અને શીરકના કામ મવજુદ છે હાલ સુધી હિંદુ-

સ્તાનમા કેટલાક છે કે જેઓ ઇસલામી જરૂરીયાતોથી અજાણ બેખબર હોવાના લીધે અ ધકાર ખાડામા ગરક છે. અથવા કોઈ અમલથી દુર છે, અને નામનાજ મુસલમાન છે. **વલમ્માયુદ ખેલલ ઈમાનો ફીકુલુબેહીમ** (હાલ સુધી તેમના દીલમા ઈમાન દાખલ થયુ નથી) તો પછી તેમના દુષ્ટ કર્મો થકી, ઇસલામને કશી જાતની બદનકશી લાગતી નથી મતલબ કે મુસલમાનોમા હાલની રજીલ કોમોનુ હોવુ હિદુઓની મહેરબાનીનુ જ પરિણામ છે એ જાતની બદમાશ રજીલ અને કમીની કોમો હાલ પણ હિદુઓમા સ બ્યાબધ મવજુદ છે આવી જાતના લોકો જો કદી ફકત ઇસલામમાજ હોત અને હિદુઓમ નહોત તો હિદુ સાહેબોનો હક હતો, કે તે કેટલાક માણસોથી તેમના અજ્ઞાનપણાના લીધે દુર રહેતા પણ અફસોસ તો એ છે, કે એવો અજ્ઞાનવાળો જગલી રીવાજ ફકત મુસલમાન કહેવાતાની સાથેજ વ્યાજબી જણાયો છે પછી તે મુસલમાન શરીફ હોય કે રજીલ હોય, ચોખ્ખો હોય કે મેલો હોય આબરૂદાર હોય કે બેઆબરૂ હોય એતો બધાને એકજ લાઠીએ હ કારવામા આવે છે હિદુ ભલી જાતના એથી જુદા છે હિદુ હોય તો પછી તે કજર, ડુમ કે ભીગરી હોઇ કે જીનાકાર હોય, કે શરાબી હોય જુવારી હોય ક બદમાશ હોય, તે બધા ભાઈ છે જો કદી સ્વધર્મ અને સ્વજ્ઞાતીના કમીના અને બદમાશ સાથે પણ એજ પરમાણે છુતછાત રાખવામા આવત કે જેવી

મુસલમાનોથી રાખવામા આવે છે, તો પછી અમને તેમના પર કશો સવાલ નહોતો વળી અમે પણ સમજતા કે ખરેખર રજીલ કોમથી દુર રહેવુ ધાર્મિક હુકમ છે

પરિણામ

ઉપરના લખાણથી નીચે પ્રમાણે સાબેત થાય છે

૧ હિંદુઓમા હાલના જેવી છુત્તછાતનો રિવાજ મુસલમાનોના આવવા બાદ સરૂ થયો છે જો પહેલા હશે તો એવો હશે કે જેવો હાલમા હિંદુઓની જુદી જુદી કોમોમા છે

૨ મુસલમાનોમા જેટલી રજીલ કોમો મવજુદ છે કે જે આજ સુધી ઈસલામી નીતીથી અજાણ છે તે હિંદુઓની રજીલ કોમમાથીજ છે અને નામનાજ મુસલમાન છે

૩ આવી છુતછાત ફ્કત મુસલમાનોને નુકસાન અને તેમની આબરૂ લેવાના ઇરાદાથીજ છે, જો કદી આવી ખોટી રીતે જાહેરી ખરાબી અને બાતેની નાપાકીના લીધે હોત, તો હિંદુ લોકો પોતપોતાના સ્વધર્મીઓથી પણ એજ પ્રમાણે મુસલમાનો સાથે વર્તે છે, જ્યારે એ વાત નથી બલકે એ જંગલી રીવાજના હકદાર ફ્કત મુસલમાનેજ ગણાય છે તે મુસલમાન ગમે તો શરીફ્ હોય અને પાક સાફ્જ હોય પણ તેની સાથે આ નીચ વર્તણુક જરૂર કરવામા આવે છે, તો પછી અમે કહી શકીએ છીએ, કે આ ઉઘાડી ના ઈનસાફી

છે, અમને બે આબરૂ કરવા અને નુકસાન પહોચાડવાના ઇરાદાથીજ શોધી કાઢેલ છે, એના સિવાય આવા રિવાજનો બીજો કોઇ હેતુ નથી જણાતો

છુતછાતના ફાયદા **અને** નુકસાન

છુતછાતના રીવાજથી હિંદુઓને જેટલો ફાયદો અને મુસલમાનોને જેટલુ નુકસાન થયુ છે, તે તો સુર્યનીપેઠેજ જાહેર છે હિંદમા ઇસ્લામી આબાદી આ૦ કરોડ છે અને હિંદુ તેવીસ કરોડ છે, છતા પ્રમાણમા સરખાવતા મુસલમાનો બહુજ પડતી હાલતમા છે એટલે વ્યાપારમા પણ તેમની સખ્યા ઠીક નથી, અને નોકરી વર્ગમા પણ તેમની સખ્યા ઓછી છે, હિંદુઓ પોતાના આ રીવાજની જબરી પોલીસી અને એનજીર હકુમતથી બીજી કોમને બનતી કોશીશે પોતાના પગાથી ફાયદો ઉઠાવવા દેતાજ નથી, આવી છુતછાતના લીધે તમામ જરૂરી વ્યાપાર તેમના વારસામાજ ચાલ્યો ગયો કે કોઈ શહેર હોય કે ગામ, કસબો હોય કે પ્રાંત, જ્યા તમામ જરૂરી ચીજોના દુકાનદારો અને કંટ્રાકટરો હિંદુઓજ નજરે પડશે એનુ જબરદસ્ત કારણ એજ છુતછાતજ છે દરેક જાતના હિંદુ લોકો છુતછાતના લીધે મુસલમાન દુકાનદાર પાસેથી કોઇપણ ચીજ લઈને કામમાં લઇ શકતા નથી એટલા માટે હિંદુ વસ્તી ઘણે પ્રકારે પોતાનાજ સ્વધર્મી દુકાનદારોની સાથે આપ લે કરે છે નાદાન અને

સમજ વગરના મુસલમાનો કે જે કોમી ફાયદાથી તદન અજાણ છે, અથવા જેમને આબરૂનો ખીયાલ નથી હોતો તે પણ હિંદુઓનીજ દુકાનોનીજ શોભામા વધારો કરવાના અને તેમનેજ લાભ આપવામા જરાપણ અચકાતા નથી એટલાજ માટે મુસલમાન દુકાનદારો પોતાના વ્યાપારમા જોઈતી ફતેહ મેળવી શકતા નથી

અમે ઘણીવાર જોયુ છે, કે પહેલા તો મુસલમાનોને દુકાનદારી કરતા શરમ આવે છે કેમકે એ લોકો સાધારણ રીતે થોડા વ્યાપાર કરવાને પોતાની બે ઇજ્જતી ગણે છે, જો કોઈ મરદે ખુદા કોઈ જાતની દુકાન ખોલવાની હીમ્મત કરે છે તો કેટલાક દીવસ પછી તેની શેળી એમજ કરકરી થઈ જાય છે,

આવા નવા ફસલાનેજ કાયદા કયાથીજ થાય કેમકે હિંદુ લોકો ધાર્મિક હુકમ અને કોમી નુકશાનના કારણે મુસલમાન દુકાનદારોની નીકલથી ઘણો સુધી નારી જાય છે વળી મુસલમાનોમાથી એકંદે પચાસ, હિંદુઓના દેવામા ફસાયલા રહે છે, એટલે સરખાપણુ ન હોવાના લીધે તે બચારો થોડા દિવસમાજ નુકશાન ઉઠાવીને નાસી જાય છે એની ખરાબ અસર એ થાય છે કે બીજા કેટલાક લોકો પોતાના હારી બેસેલા ભાઇની હાલત દેખીને આઇંદા વ્યાપારથી નિરાશ થઇ જાય છે એજ કારણથી મુસલમાનો

વ્યાપાર તરફ ધ્યાન બહુજ ઓછુ રાખે છે હવે તે મુસલમાનોનો હેવાલ સાભળો કે જેઓ ધધો અને હુન્નર કરે છે

એ લોકોની મહેનતથી ઘણુ હિદુ દુકાનદારોજ કાયદો અને લાભ લે છે, મુસલમાનો કારીગર વહાણાથી સાજ સુધી જે કાઈ બનાવે છે તે હિદુઓનેજ આપે છે એ લોકોને દીવસના ત્રણ ચાર આના મુશ્કેલથી પડતા હશે પણ હિદુઓ એમની સખત મહેનતથી પુરતુ લાભ લે છે લવાર કનારી વણનાર લુગડા વણનાર, તારકશ વીગેરે કામો એ એ વાતે સરખા છે તેમાથી દાખલા તરીકે એક કામનુ વર્ણન આપને અરજ કરૂ છુ

મશરૂ વણવાનુ કામ અહી ઘણુ ચાલે છે, ને લાખો રૂપીઆનો મશરૂ જુદા જુદા પ્રકારનો તયાર થઈને બીજા મુલકોમા ભારી કીમતે વેચાય છે હિદુ દુકાનદારો બીજા મુલકથી રેશમ મગાવે છે તે અહી આવીને પહેલા સાફ કરાવવામા આવે છે, તે સાફ થઇને રગરેજને ત્યા પછી ત્યાથી પાનારાઓને ત્યા પછી રાજભગને ત્યા અને ત્યાથી વણકરને ત્યા વણવાને મોકલવામા આવે છે ત્યાથી તયાર થઇને હિદુઓ પાસે પહોચી જાય છે, એટલે અહી અથાગ નફો લઇ વેચવામા આવે છે, કામ કરનારા મુસલમાન જેમની અથાગ મહેનતથી એ મશરૂ તયાર થયો છે, તે બધા દર વખતે પોતાના શેઠ એટલે હિદુ દુકાનદારોના ઓશીઆળા રહે છે

આવી જાતનો વ્યાપાર તે ગમે તો છુતછાતથી પણ દુર છે, છતા વ્યાપારમા પણ કોઈ મુસલમાનને હિંદુઓ આગળ વધવા દેતા નથી, જો કદી કોઈ મુસલમાન આવી દુકાન કરે તો બસ બધા હિંદુઓ સંપ કરીને એને બરબાદ કરવામા જરાપણ બાકી નથી રાખતા

ઉપર પ્રમાણે હિંદુ લોકો દરેક વખતે અમે મુસલમાનો ને નાબુદ કરવાને તઈયાર રહે છે અને એજ પ્રમાણે નેકરી વર્ગમા પણ જોવામા આવ્યુ છે

સરકારી ઓફીસોમા અને ગવર્નમેન્ટી નોકરીઓમા પણ હિંદુઓની સંખ્યા બહુજ વધારે છે, ઉંચા હોદાઓથી લઈને અદના નોકર સુધી બધા એજ હિંમતવાન પણ હટધર્મી કોમોના નવ જુવાન જોવામા આવે છે મુસલમાનો તમના પ્રમાણમા એવા છે જેવા કે આટામા મીઠુ તો પણ એ લોકો હમેશ મુસલમાનોને તકલીફ અને અડચણો કરવા ચુકતા નથી તેમને બર તરફ કરવાની કોશીશમાજ રહે છે સેકડો આબરૂદાર હોદેદાર મુસલમાનો ફકત મુસલમાન હોવાને લીધેજ બે આબરૂ થયા કેટલાક આબરૂદાર મુસલમાનો પર જુઠા કેસ લાગુ પાડવામા આવ્યા વળી તેમને પેપરદ્વારે બદનામ કરવામા આવ્યા, તેમને હાકીમોની નજરમા તુચ્છ દેખાડવાની કોશીશ કરવામા આવી અને કરવામા આવે છે, મતલબ કે ધોળા લુગડા વાળા આબરૂદાર મુસલમાનો તે ગમે તો વ્યાપારી હોય કે અંગરેજી

ગવર્નમેન્ટના નોકરો હોય પણ આવા હરીફોની આખમા કાટા સમાન ખુચ્યા કરે છે જે દોસ્તોને એમની પાડોશમા રહેવા અથવા એમની સાથે કોઈ ઓફીસમા નોકરી કરવાનો વખત મળ્યો છે, તે આ બાઈબ ધોના હથકંડાથી સારી પેઠે વાકેફ છે

ટુંક સાર એ છે કે આ વખતે હિંદના હિંદુ ભાઈઓ અમે મુસલમાનોને નાબુદ કરવાની ફીકરમા છે, જો કદી મુસલમાનોએ પોતાની સંભાળ અને પોતાની કોમની લાચારી દુર કરવાની કોશીશ કરી નહિ, તો પછી અમારી આઇંદા હાલત હાલ કરતા પણ વધારે ખરાબ થઈ જશે

હેતુ

પ્યારા વાચકો ! આ સઘળી સાચી રામકહાણીનો હેતુ અને દીલનો દર્દ જાહેર કરવાની મતલબ તો આપ જરૂર સમજી ગયા હશો હવે અમારે એવી તજવીજો કાઢવી જોઈએ, કે જેથી અમે પોતાની કોમમા વ્યાપારનો ખ્યાલ પેદા કરી શકીએ, આપણ આપણા બેનસમજ ગાફેલ ભાઈઓમા કોમી ખીચાલ અને એક બીજાની હમદર્દીના સાનેરી કાયદાઓ જમાવી શકીએ જે મુસલમાનો હિંદુઓની પાસેથી નાપાક અને પલીદ ચીજો ખરીદીને ખાય છે અને તેમની પાસે પોતાની બેઈજ્જતી કરાવે છે તેમને મુસલમાનોની સાથે ખરીદ વેચાણ કરવાનો શોખ આપીને આ બે ઈજ્જતીથી અને બેગેરતીથી બચાવીએ, જેમ બને તેમ

મુસલમાનનો પઈસો ગેર કોમના હાથમા જતો અટકાવીએ, જો કદી અમારા ધર્મી વિદવાનો, આલીમો આ તરફ ખ્યાલ કરે, તો એ કામ સહેલાઈથી થઈ શકે છે અમારા આલીમો જેવી રીતે મુસલમાનોની આકિબત સુધારવાના કામમા લાગી રહે છે, તેવી રીતે દુનીયાની ખેરખાહીના સામાન પણ એકઠા કરવાની કોશીશ ફરમાવ્યા કરે તો અમારી તમામ મુશકેલીઓ દુર થઈ શકે છે ત્યારે ઉલમાએ દીનની આબરૂ કાયમ રહેશે કે તેમના પેરોકાર-હુકમ માનનારાઓ સારી હાલતમા હોય, અને હાલત સુધારવાની એનાથી સારી કોઈ તજવીજ નથી હોઈ શકતી કે મુસલમાનો દરેક જાતની દુકાનો ઉઘાડે, દરેક ખાતામા પગલા આગળ ભરે, દરેક દુનીયાવી અને દીની કામમા એક બીજાની મદદ કરે

જેવી રીતે હિંદુ લોકો પોતાની કમાઈનો એક પઈસો પણ અમે મુસલમાનો સુધી પહોચવાદેતા નથી તેવી રીતે અમો મુસલમાનો પર પણ ફરજ છે, કે અમે પણ પોતાના માલો દોલતને બીજાઓના હાથમા જતી અટકાવીયે, કુરાનશરીફની એક આયત છે (ઇનનલજીના કફરૂ બાદહુમ અવલીયાઓ બાદ અલ્લા તફઅલુહો તકુન ફીતનતુન ફીલ અરદે વ ફસાદુન ખબીર (અય મુસલમાનો તમે જુવો છો કે કાફર લોકો એક બીજાના ભાઈબધ દોસ્તદાર છે, તે તમે પણ એવુજ સપ ન કરશો તો દુનીયામા અનેક જાતના ફીતના અને મોટા ફસાદ ઉઠશે

ઉપરની આયતમા અમને ખુલ્લી રીતે હીદાયત કરવામા આવી છે, કે અમે મુસલમાનો દુનીયાવી અને દીની મામલામા બધા સરખી રીતે મળીને કોશીશ કરીએ, અને તેમા બીજાની મદદ કરીએ જો કદી અમે આ થોડા દીવસની જીંદગી હળી મળીને નહિ ગુજારીશુ તો જરૂર અમને એવા સખત નુકસાનો અને મુશીબત સહન કરવી પડશે કે જે કુસંપીના પરીણામમા જાહેર થાય છે

હિન્દુ આભડછેટ.

આ વાત તો ખરેખર માનેલીજ છે, કે હિન્દુ આભડછેટ પ્રાચીન કાળથી નથી અને એ નાની ઉમરનીજ છે એનો સબધ હિન્દુ ધર્મ સાથે કાંઈ પણ નથી પરતુ આ વિષય પોલીટીકલ અથવા વ્યવહારિકજ છે

જો કદી આટલુજ હોત, તો પણ કાંઈ વાંધો નહોતો પરતુ હવે તો માનસિક શ્રેષ્ઠા ને કલક લગાડી એકયતા અને સ્વતત્રતાની શત્રુ બની માણસાઈ અને હમદરદી ઉપર અસહય હુમલો કરવાના દરજ્જે પહોચી છે, એટલાજ માટે કે તેમા એક બીજાની તરફ તિરસ્કાર ઈર્ષા અને અશાતીનો જુસ્સો છુપેલો મવજુદ છે એટલે તે સદતર ધિક્કાર સાથે તુચ્છ કરવાને લાયક છે

આભડછેટનો સબધ શુ હિન્દુ ધર્મની સાથે છે? એ સવાલનો જવાબ માટે અમારે હિન્દુ ઇતિહાસની તરફ દ્રષ્ટિ કરવી જોઈએ, પરતુ તેમાથી તો એનો કયાએ પતો લાગતો નથી ઇતિહાસ જો કે વાર્તા અને કિસ્સાએથી જુદોજ વિષય છે છતા નાચારતા અમારે તેજ ખોળવા પડશે.

રામાયણ અને મહા **ભારત** આ બન્ને ઉત્તમ વાર્તાઓ છે જેને દેખીને તેના રચનારની ઉત્તમ લાયકાતની સાબેતી મળે છે તેમાથી **રામાયણ** વાર્તાના હીરો અયોધ્યાના ચદ્રવશી રાજ્ય કુવર **રામ** છે જેમને જુના વિચાર વાળા હિદુઓ ઇશ્વરનો અવતાર માને છે, ને કહે છે કે ઇશ્વિર પરમાત્મા રાવણને સજા આપવાને માટે દુનિયામા મનુષ્યના રૂપે પધાર્યા છે, પરંતુ આર્ય સમાજીઓ એવી માન્યતાની હાસી ઉડાવે છે

રામાયણમા લખેલુ છે કે રામચદ્રજીના પિતા શ્રી રાજા દસરથને અનેક રાનીઓ હતી, રાજાએ પોતાની એક રાણીની હઠને લીધે, પોતાના પુત્રને પુરા ચૌદ વરસના માટે દેશવટો આપ્યો **રામચંદ્ર**ની પતિવૃતા સ્ત્રી **સીતા** અને તેમના ભાઇ **લક્ષ્મણે** વફાદારીનો હક અદા કરવા સગત મુકી નહિ આ લોકો દક્ષિણ હિન્દુસ્થાનની મુસાફરી કરતા લકા સુધી જઈ પહોચ્યા આ બાજુ અનાર્ય લોકો વસતા હતા, અહીના રાજા રાવણ સાથે રાજ્ય કુવર રામચદ્રજીને અણુ બનાવ થઈ ગયો, **રામ**ના ભાઈ **લક્ષ્મણે** રાવણની બેન કુવરી સ્વરૂપનખાનુ નાક કાપી નાખ્યુ, એટલે રાવણ ક્રોધે બળી **રામ**ની સ્ત્રી **સીતાને** લઈ ગયો હવે **રામે** દક્ષિણના અનાર્ય કોમની મદદથી લકા ઉપર ચઢાઇ કરી અને તેમા **રાવણ** માર્યો ગયો

રામ ક્ષત્રી અને આર્ય હતા દક્ષિણ હિન્દુસ્થાનમા જે અનાર્યો એ તેમને સહાય કરી તે લોકોને આજકાલની બોલચાલમા શુદ્ર અછુત (અડકવાને લાયક નહિ) કહેવામા આવે છે, પરન્તુ મજકુર ખુલાસાથી સાબીત થાય છે, કે તે બન્નેમા કેટલો બધો સબધ હતો ? રામાયણમાજ છે કે **રામચંદ્રે** એક ભીલ સ્ત્રીના એઠા કરેલા બોર ખાધા એટલે **રામાયણ** ના લખાણ ઉપર હિન્દુ આભડછેટ ની વિરૂદ્ધતા નીકળે છે

મહાભારતમા કૌરવ અને પાડવ વિષેનુ વર્ણન છે આ બન્ને સગાભાઈઓની ઓલાદ હતા કૌરવનો બાપ આધળો હતો તેથી રાજપાટને લાયક નહોતો અને જેથી પાડુ રાજપાટ લઈને રાજય કરવા લાગ્યો આધળા ભાઈનુ નામ ધ્રુત રાષ્ટ્ર હતુ તેના એકસો પુત્રો હતા અને પાડવ ફકત પાચ ભાઈઓ હતા કૌરવો પોતાનો હક લેવાને માટે તયાર થયા અને પ્રપચી જાળ પાથરી જુગારમા તેમનુ રાજય જીતી લીધુ, એટલુ જ નહિ પરન્તુ તેમની રાણી દ્રાપદિને પણ જીતી લીધી હવે પાડવો થએલી શરત પ્રમાણે ચૌદ વરસને માટે દેશ વટે ગયા જયારે પાછા આવ્યા ત્યારે રણ ક્ષેત્રમા એક મહાન યુદ્ધ થયુ છેવટે પાડવોની જીત થઈ આ લડાઈમા શ્રીકૃષ્ણ અને ચન્દ્ર પણ આવ્યા હતા બલકે લડાઇ માટે ઉશકેરનારા તેજ હતા સનાતન ધર્મી હિન્દુઓ શ્રીકૃષ્ણને ઇશ્વર અવતાર માને છે

દિલચસ્પીને લીધે કલમ કયાએ ચાલી ગઈ છે કહેવાની વાત તો એ છે, કે મહા ભારતના જમાનામા છુતનો વજુદ નદન નહોતો બલકે કહેવામા એમ આવે છે કે હિન્દુઓની પડતીની શરૂઆતજ ત્યારથી છે વળી દાવો કરીને કહેવાય છે કે મહાભારતના યુદ્ધમા આખી દુનિયાના રાજાઓ એટલે યુરોપ અને અમેરિકાના રાજય કરતાઓ પણ આવીને ભળ્યા હતા એટલે છુત અછુત ત્યા હોઈ શકેજ નહિ એ શીવાય શ્રી કૃષ્ણ જેવા પવિત્ર અને મહાત્મા કહેવામા આવે છે તે એક ચામડીઆ ખાટકીના ઘેર મહેમાન થાય છે અને તેનુ નોતરૂ કબુલ કરે છે. એટલે છુત અછુતના ભુક્કા રદીઆ થાય છે મતલબ કે રામાયણ અને મહાભારતમા આભડછેટનો ઉઘાડો રદીઓ છે

તમામ હિંદુઓ એ ચાર વર્ણમા વહેચાયલા છે બ્રાહ્મણ, ક્ષત્રી, વઇષ અને શુદ્ર પરંતુ આર્યસમાજીઓએ વેદિકજ્ઞાનથી બરોબર કહી દીધુ છે કે આ વહેચણી જન્મ પ્રમાણે નથી પરંતુ કર્મ પ્રમાણે છે એટલે કોઈ હિંદુ જન્મથી બ્રાહ્મણ અથવા શુદ્ર હોતો નથી, તેના કર્મ થકી બને છે એટલે જે માણસ પહેલેથીજ વિદ્યાજ્ઞાન પ્રાપ્ત કરે તે બ્રાહ્મણ જે લડવઈઓ યોદ્ધો અને શુરો બને તે ક્ષત્રી વેપાર વણજને ખેતી કરે તે વઇશ્ય છે અને હલકાને નીચ નામના કરનારાઓ શુદ્ર છે

ઉપરનો ખુલાસો પણ આભડ છેટને રદ કરે છે શુદ્રના પુત્ર આગળ વધીને બ્રાહ્મણ અને વઇશ્યનો છોકરો કાલે ક્ષત્રી બની શકે છે વળી બનવા જોગ છે કે બાપ શુદ્ર, પુત્ર બ્રાહ્મણ પૌત્ર ક્ષત્રી અને પછીનો પરિવાર વઇશ થાય ! એટલે હવે આભડ છેટ કયા રહી છે છતા અમારી પાસે આભડ છેટની વિરૂદ્ધ એનાથી વધારે મજબુત સાબીતીઓ મવજુદ છે,

મનુજી મહારાજ હિન્દુ લોના કર્તા છે હિન્દુઓમા હઝરત ઇમામ આઝમ (રહ૦) નો તેમનો દરજ્જો છે મનુજી મહારાજે વેદોમાથી કાયદાઓ કાઢયા અને કાર્યકર્મની વિગત દર્શાવી છે મનુસ્મૃતિ નામની મોતબર અને મશહુર કિતાબ છે મનુસ્મૃતિમા લખેલુ છે કે એકજ વખતે ચાર સ્ત્રીઓ પરણવાની છુટ છે પરન્તુ નિયોગ અથવા અમુક વખત માટે પૈસા ઠરાવીને સ્ત્રી ભોગવવાની મના છે એના આર્ય સમાજીઓનુ સાહસ છે કે બ્રાહ્મણ ચાર, ક્ષત્રી ત્રણ વઇશ્ય બે અને શુદ્ર ફકત એકજ સ્ત્રીને પરણે અને તે પોતાના કુટુંબમાથીજ પરણે મનુજીમહારાજ કહે છે કે રૂપાળી સુંદરીને નીચજાતીમાથી પણ લઇ લેવી જોઇએ, આ કાયદાનો અમલ એવી રીતે થયો કે, ઘણા બરા હિન્દુ રાજાઓએ નીચજાતીની સ્ત્રીઓ (માછીઆરણ અને ખલાસણો) ની સાથે પરણ્યા છે (જૂઓ શકુન્તલા અને ભિષ્મ પિતામા)

આ ખુલાસા વાર વિગતથી ઉઘાડુ જ છે કે બ્રાહ્મણ, ક્ષત્રી વઇશ્ય અને શુદ્રના એક બીજાની વચ્ચે આભડ છેટ નુ હોવુ તદ્દન અશકય દેખાય છે વળી મનુજી મહારાજ આભડ છેટને માટે ખુલા સાવાર ફરમાવે છે કે બ્રહ્મણ, ક્ષત્રી, વશ્ય અને શુદ્રોનુ ખાન પાન એકજ છે કેમકે જ્ઞાતિવર્ણ નું કારણ કર્મ છે

એના લીધેજ દુનિયાની સવળી કવમોની સાથે ખાવુ પીવુ અને કન્યા વ્યવહારની છુટ છે હિન્દુ વાતાઓમા જે ને ઇતિહાસની પકિત આપવામા આવે છે કેટલાક અણ સમજ્યા નામ લેવાયા છે, તેને આર્યા સમાજના જ્ઞાની વિદ્વાનો કહે છે કે અમેરિકા અને યુરોપના મુલકોના આ બધા નામ છે અને ત્યા હિન્દુ રાજ્ય કરી હતે વળી ત્યા ના રાજ્ય કર્તાઓનુ ત્યાનીજ સ્ત્રીઓ સગે પરણવુ પણ વર્ણવેલુ છે, તો પછી એથી કરીને પણ આભડ છેટનો નહીઓ થાય છે

મનુજી મહારાજે ફેસલો આપેલો છે, કે પરજ્ઞાતી (બીજી કવમ સાથે) ખાવુ પીવુ અને કન્યા વહેવારની છુટ છે, કદાચ એમા મુસલમાનો પણ આવી ગયા હશે શુ આ વાત માનવામા પણ કાંઈ વિલબ હશે કે !

ઉપરના લખાણથી સ્પષ્ટ જણાઇ આવ્યુ કે હિન્દુઓના જુદા જુદા વર્ગોમા આભડ છેટ કદી પણ હતી નહી એટલે

સુધી કે રામચંદ્રજી અને શ્રી કૃષ્ણજી એ ચામડીઆ ખાટકીના ઘેર જઈને તેનુ ખાણુ ખાધુ વળી બહોળા વર્ગ હિન્દુ જ્ઞાતિઓ અને કુટુંબોમા ચામડીઆ ખાટકી પણ ગણાય છે હાલના જમાનામા ફકત ગરીબ મુસલમાનોને કોઈ ખાસ કારણોના લીધે જ્ઞાતિમાથી જુદા કાઢયા છે, એટલુજ નહિ બલકે માનસિક વર્ણમાથી કાઢી મુકયા છે આવી મહેરબાનીનો અમો આભાર માનીએ છીએ 'તુને ચોહ ઠોકર લગાઈ ચશમે મિલ્લત ખુલ ૦૦

આભડ છેટ શુ છે ? અહંકાર છે બાઈકોટ છે, અસહ્ય દબાણ છે, અસ્પ્રુતોના વિરૂદ્ધ અલટીમેટમ છે, કે કાતો અમારામા ભળી જાઓ અમારો ધર્મ કબુલ કરીલો નહિ તો બેઈજ્જતી અને તિરસ્કાર કરવામા આવશે તમારૂ નામ દુનિયાના પડદા ઉપરથી નાબુદ કરવામા આવશે પોતાના ધર્મનુ ધોસરૂ જબરાઈથી બીજાને ગળે નાખવાનુ જ નામ અભડ છેટ છે એટલે બળાત્કારે પોતાના ધર્મનો પ્રચાર કરવો હાલના જમાનાની અશુદ્ધીની ચળવળે આ ભેદને તદન ઉઘાડો કરી દીધો છે પરંતુ તાજુબીની વાત તો આ છે કે બળાત્કારે ધર્મ પ્રચાર કરવાનો આરોપ મુસલમાનોના માથે થોપવામા આવે છે, ખરૂ જોતા ઈસ્લામની પવિત્ર કિતાબે દુનિયામા જાહેર નોટીસ આપી દીધી છે, કે **લાઇકરાહા ફિદ્દીન** ધર્મની બાબત જરાએ બળાત્કાર નથી

બ્રાહ્મણો અને બૌધ ધર્મવાળાઓ વચ્ચે યુદ્ધ થઈગયા, તલવાર ચાલી ગઈ તેને થોડોક સમય વીત્યો, છતા અમારા સ્વદેશી બંધુઓ તેને તદ્દન ભુલીજ જાય છે

આ એક ઇતિહાસિક હકીકત છે, કે અરબસ્તાન અને હિન્દુસ્તાન અને તેની આસપાસના બેટ, લંકા વગેરેમા ઇસ્લામની પહેલા પણ વ્યાપાર સબંધ હતો અને અહી આ અરબલોકો વ્યાપાર અર્થે આવતા જતા હતા, હિન્દ વાસીઓ સાથે લાગવગ હતી અને હિન્દુઓ તેમનાથી આભડછેટ ગણતા નહોતા પછી ઇસ્લામ પ્રગટ થયા બાદ બહોળો સબંધ થઈ ગયો, આ વખતે તે જમાનો હતો કે જ્યારે બૌધ મતને વેદક ધર્મ તલવારના જોરથી નાબુદ કરતો હતો અને તે મરણ વખતનો છેવટનો શ્વાસ લઈ રહ્યો હતો

દક્ષિણ હિન્દુસ્તાનના મલબારના એક હિન્દુ રાજાએ **"મોઅ જિઝએ શકકુલ કમર'** (હઝરત રસુલ કરીમના ઇશારા થકી ચંદ્રમાના બે કકડા થઈને જમીન ઉપર આવવા વિષેનો) ચમત્કાર ખુદ પોતાની આંખે જોઈને કેટલાક માણસોને તેની તજવીજ કરવા માટે મોકલ્યા એટલે તેને માલુમ પડયુ કે એ અરબી પયગમ્બર (સ. અ. વ. સ.) નો ચમત્કાર હતો એટલે રાજા પોતે અરબસ્તાન તરફ રવાને થયો અને ત્યા જઈને મુસલમાન થઈ ગયો અને ત્યાજ મરણ પામ્યો.

આ બનાવ ઉપરથી પણ આભડ છેટના રીઓ થાય છે. તે વખતે જો કદી આવો રિવાજ હોત તો રાજા પોતાને ઘેરથી બહાર કેવી રીતે જઈ શકત ? અને ઇસ્લામી મુલક અરબસ્તાનમા કેવી રીતે જતે ?

મલબારનો મોઅતબર માન્ય પામેલો એકજ ઇતીહાસ ' તોહફતુલ મુજાહેદીન નો લખનાર પોતાની આખે દેખેલા બનાવો એવી રીતે જાહેર કરે છે કે "મુસલમાનોના વ્યાપારના લીધે હિન્દુસ્તાનના પશ્ચિમ કીનારાના બદરોની વસ્તીઓમા ઘણો બહોળો વધારો થયો છે (એટલાજ માટે) આહીના સરદારો અને રાજાઓ ઇસ્લામની મોટી ઇજ્જત કરે છે હીદુ રાજાઓ મુસલમાનો સાથે પ્રેમ અને માન્ય સાથે સદવર્તણુક રાખે છે આ ઇતીહાસીક લખાણથી શુ એ વાત સાબીત નથી થતી ? કે તે વખતમા મુસલમાનોને મલેચ્છ કહીને તેમની સાથે આભડ છેટ રાખવામા આવતી નહોતી ?

ઇરાકનો એક મુસ્લીમ વ્યાપારી **સુલેમાન સિરાફી** હીજરીના ત્રીજા સનમા હીન્દુસ્તાન આવ્યો અને તેણે પોતાનુ સફરનામુ લખ્યુ જેને ફ્રાન્સીસી યુરોપીયન રીનાડે ફ્રાન્સ તરજુમાની સાથે સને ૧૮૪૪મા પ્રગટ કર્યુ **સુલેમાન** લખે છે કે, " હીન્દુસ્તાન અને ચીનના લોકો યકીન રાખે છે. કે દુનીયામા મોટામા મોટા મહારાજા ધીરાજ ત્રણ છે

અને તેમા સૌથી મોટો શાહે અરબ (બગદાદનો ખલીફા) છે જે સૌ કરતા વધારે દોલતમદ, રોબદાબ વાળો અને ધર્મ નિષ્ઠ ધર્મ બાદશાહ છે, જેનાથી મોટી કોઇપણ ચીજ નથી

આ સફરનામામા એવુ પણ લખ્યુ છે, કે "હીન્દુસ્તાનમા સૌ કરતા મોટો રાજા **બળહારે** રાજા છે આ રાજવશી રાજાઓની ઉમર ઘણી લાબી હોય છે અને અહીની પ્રજાની માન્યતા એવી કે અહીના રાજાઓની ઉમર લાબી હોવાનુ કારણ ફકત એજ છે કે, તે બીજા બધા રાજાઓ કરતા મુસલમાનો સાથે વધારે મોહબ્બત અને પ્રીત રાખે છે અને પ્રજાપણ મુસલમાનો સાથે વધારે મોહબ્બત રાખે છે હવે અહી વીચાર કરોકે તે હીદુઓ મુસલમાનોથી શુ આભડ છેટ રાખતા હશે ? એજ વેપારીનુ વર્ણન છે કે ગુજરાત અને દક્ષીણના રાજાઓ પણ **બગદાદ**ના ખલીફા ને દુનીયામા સૌ કરતા મોટો બાદશાહ માને છે અને મુસલમાનો સાથે ઘણી ઈજ્જત અને મોહબ્બત તથા સદ વર્તન રાખે છે

ઇરાનનો એક મુસલીમ વહાણ વટી પોતાના ' અજાએબુલ હીન્દ નામના પુસ્તકમા એક નવ મુસલીમ હીન્દુને માટે કેટલીક હકીકત લખે છે પરતુ તેમા એવુ લખેલુ નથી કે હીન્દુઓ તેનાથી આભડ છેટ રાખે છે એ મુસાફરી કરનારનુ નામ **બુઝુર્ગ** બીન **શહેરયાર** છે

આ જમાનામા મલબાર અને કાલીકટના રાજાઓના ઇલાકાઓમા મુસલમાનોની સંખ્યા એટલી તો વધી ગઈ છે, કે તે રાજાઓને તેમના માટે એક **કાઝી** રાખવો પડે છે જાવામા પણ મુસલીમ વ્યાપારી મવજુદ છે, અને ત્યાના રાજાના દરબારની રીત રીવાજ પ્રમાણે **સલામ** દંડવત પ્રણામની તેમને માફી છે સીંગાપુરના રાજાના દરબારમા પણ મુસલમાનો મવજુદ છે આ તમામ હકીકતો ને લઈને માનવુ પડશે કે તે હીન્દુ રાજાઓ અને હીન્દુ પ્રજા હઠ ધર્મી નહોતી વળી મુસલમાનો સાથે આભડછેટ રાખતી નહોતી **બુઝુર્ગ** બીન **શાહરયાર** લખે છે, કે હીન્દુસ્તાનના જોગીઓ અને સાધુઓના ઘણા વર્ગ છે તેમા એક પેકુર (પેકુડર) છે તેમનુ મુળ સીંગલદ્વીપ (લંકા) છે તે ઓ મુસલમાનો સાથે વધારે મોહબ્બત રાખે છે અને તેમના તરફ બેહદ પ્રેમ ભાવ દાખવે છે

અજાએબુલ હીન્દમા એ પણ લખેલુ છે કે, "જ્યારે લંકાવાળાઓને હઝરત નબી (સ. અ. વ. સ.) નો હાલ માલુમ પડયો ત્યારે તેમણે એક માણસ તજવીજ માટે અરબસ્તાન મોકલ્યો હતો અને તે સમય હઝરત **ઉમર ફારૂક** (રદી,) નો હતો પરંતુ તે પાછો ફરતા રસ્તામાજ મરી ગયો અને તેનો ગુલામ સેવક બરાબર લંકા **પહોચી** ગયો અને તેણે તમામ હાલ કહી સંભળાવ્યો અને તે પછી

અહીના તમામ માણસો મુસલમાનોનુ અદબ કરવા લાગ્યા, એટલે એના પરથી શુ આભડછેટનો ખીયાલ આવી શકે છે !

મુસલમાન વ્યાપારીઓ મુસાફરો અને ઇતિહાસ કર્તા ઓના પુસ્તકોમા એવા બનાવો બેશુમાર મળીઆવે છે જેનાથી સાબીત થાય છે કે આજથી હજાર બારસો વરસ પહેલા હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે આભડછેટની ધિક્કાર ના લાયક દિવાલ ઉભી નહોતી મસઉદના ઇતિહાસ 'મિરવજુઝ ઝહબ' મા લખેલુ છે કે રાજા બલહાર, સિન્ધ અને હિન્દના તમામ રાજાઓ કરતા મુસલમાનોની વધારે ઇજ્જત કરે છે તેના રાજ્યમા ઇસ્લામ આબરૂદાર અને રક્ષિત છે આ ઇલાકામા મુસલમાનોની મસજીદો અને જુમ્મા મસજીદો પણ બેશુમાર છે અને વળી તે આબાદ છે અહીના મહારાજાઓ ચાળીસ ચાળીસ પચાસ પચાસ વરસ સુધી રાજ્ય કરે છે પ્રજાની માન્યતા એવી છે કે રાજાઓની લાંબી ઉમર મુસલમાનોની ઇજ્જત કરવાના પ્રતાપે છે આ બધી વીગતો આભડછેટ ને રદ કરે છે હવે કયા સુધી લખવામા આવે !

તેની પછી હિન્દુસ્તાનમા મુસલમાની રાજ્યનો દૌર દોરો થાય છે અને સિન્ધમા એકબ્રહ્મણની મદદ જાહેરમા ઇસ્લામના વિજયની મુદ્રા બને છે મુર્તિ ખંડક સુલતાન મહમુદ ગિઝનવી (૧૦૦૦) ની ફોજમા હિન્દુ સિપાઇઓ

ઇસ્લામી વાવટા નીચે તલવારો ચમકાવતો નજરે પડે છે મહમુદી ખજાનાનો ખજાનચી હિન્દુ છે. અને આ બધુ ઇતિહાસીક સત્તાવાર વાતો છે કલ્પિત નથી તો હવે સમજવા નુ એ છે કે જો કદી બન્ને અજાણી જ્ઞાતિઓ વચ્ચે અછુત પણુ હોત તો આવા બનાવો કયાથી બનતે ?

હિન્દુસ્તાનમા ગઝનવી, ગોરી ગલામ, તગલક, ખલજી, અફગાન અને મુગલ બાદશાહોના દરબારોને જરા ગૌર કરીને નજર કરશો તો ત્યા હિન્દુ અને મુસલમાનો ઓહેદારો શુ ખભેખભા મેળવીને ઉભા દેખાતા નથી ? અને તે લોકો આપસમા શુ ભાણા વહેવાર કરતા નહોતા ?

મુગલ બાદશાહોના જમાનામા તો વળી હદ થઇ ગઇ હતી કે, અકબરી પોલીસીએ તો રહીસહી જુદાઇનો નાશજ કર્યો ત્યા તો **મનતો શુદમ તુમન શુદી** વાળો આબેહુબ ચિતારો આખોની હજુર દેખાયો છે હિન્દુ અને મુસલમાન બન્ને આપસમા કન્યા વહેવારની સોનેરી સાકળોથી જકડાઇ ગયા હવે કોઇ છે ? કે આ બધા બનાવોનો ઇનકાર કરી શકે ? એવી વર્તણુકમા આભડછેટનો અશ પણ બાકી રહી શકે કે ?

આ તમામ વિગતનો સાગરા એજ છે કે, અભડછેટ કાઇ હિન્દુઓનો ધાર્મિક વિષય નથી કે જેની પાબન્દી જરૂરી

હોય મનુજીના કહેણ ઉપરથી તો આભડછેટનો તદન નાશજ થાય છે, એટલે આભડછેટ વૈદિક જ્ઞાન શિક્ષણથી તદન વિરૂદ્ધ છે વળી આપણને સાબિતી મળી છે કે પુરાતન હિન્દુઓ મુસલમાન સાથે આભડછેટ તદન રાખતા નહોતા આ નવુ વર્તન ફકત હાલના નવા જમાનાની ખાસ ચળવળજ છે

કમેટીના મૌલાના.

આ એક મનોરંજક નૉવેલ છે એમાં ધાર્મિક વિદ્યાજ્ઞાન વગરના ગેરવાજબી લેકચરોના પ્રતાપે બની બેઠેલા મૌલાનાઓ હિન્દુ મુસલમાનની એકયતાના નિશામાં ચકચુર થઈને ઈસ્લામી શરીઅતની વિરૂદ્ધ જુદી જુદી જગ્યાએ ભરડી ગયા છે તેનું ગુજરાતી ભાષામાં અને ગુજરાતી અક્ષરોમાં વિસ્તારથી નૉવેલ રૂપે વર્ણન છે આવા મઝહબી ઝગડાઓના જમાનામાં તેના ખ્યાલથી મુસલમાનોનું કેટલું નુકસાન થયું છે અને થાય છે તે કહેવાની હવે જરૂર નથી માટે મજકુર નૉવેલને જરૂર વાંચી એવા બનાવટી મૌલાનાઓથી બચવા તજવીજ કરશો કીમત ૦–૪–૬ સાડાચાર આનાની ટીકીટ મોકલીને મગાવશો

કવમી લીડરોની ઈસ્લામી સેવાઓ.

આજકાલના કવમી લીડરો જે ઈસ્લામી મસલા બજાણવાન મહજ હિન્દુઓની તરફદારી કરવાના શરીઅત ઓળંગીને કયાંનું કયાં બોલી ગયા છે, જેનાથી હિન્દુઓ મગરૂર થઈ ઈસ્લામ પર હુમલા કરતા થયા છે, તેનું ગુજરાતી ભાષામાં અને ગુજરાતી અક્ષરોમાં વિસ્તારથી વર્ણન છે આજકાલ પોતાના પવિત્ર ઈમાન બચાવવા ખાતર દરેક મુસલમાન ભાઈએ વાંચવાની ખાસ જરૂર છે કીમત ૦–૨–૬ અઢી આનાની ટીકીટ મોકલીને મગાવશો

તેજસ્વી દિલનો પ્રકાશ

આ પુસ્તકમાં આર્યસમાજીઓના મુકાબલામાં પાક ઇસ્લામની સચ્ચાઈ સચોટ દલીલોથી એવી રીતે સાબીત કરી છે કે ગમે તેવો ઇસ્લામનો વિરોધી માણસ હોય, તોપણ તેને માની લીધા વગર છુટકોજ ન થાય. આ શુદ્ધિની હિલચાલના વખતમાં એક મુસલમાન બાઈએ પોતાની પસંદ અસરથી લખી છે અને એ પણ ગુજરાતી ભાષામાં અને ગુજરાતી અક્ષરમાં રસિક વર્ણનવાળી કિતાબ છે. કી. ૦-૪-૦ સાથે ચાર આનાની ટીકીટ મોકલી મંગાવજો.

આર્ય ધર્મની કસોટી—આ પુસ્તક ગઝનવ મદ્રસા મોહમ્મદીયા અખ્બારના તરફથી પ્રસિદ્ધ થએલું છે, તે ભીડવારનો ઇસ્લામી સત્ય પ્રગટતો માસિક નૂર ઇસ્લામના કેટલાક અંકોમાં પ્રગટ થઇ ગએલું છે. એમાં ધાર્મિક કસોટીના નિયમો બાંધીને પછી તેના પ્રમાણમાં કુરાનના પુસ્તક અને તમામ વેદોને સારી પેઠે અજવાળામાં આણી ઇસ્લામજ સત્ય ધર્મ છે અને આર્ય ધર્મ નકલી વતીગજ છે એમ સાબીત કર્યું છે, આ પુસ્તક ફક્ત મુસલમાનોની જાણ માટેજ અમે પ્રગટ કરેલું છે, પૃષ્ઠ ૮૦ ઉંચા કાગળ અને સુંદર છપાઈ સાથે કીમત ફક્ત ૦-૦-૦ ટપાલખર્ચ આનાની ટીકીટો મોકલીને મંગાવજો.

અયસે મઝહબી મુશકિલોં કે ઝમાને મે હરેક મુસલમાન ભાઈ કે પાસ જરૂરી રખને કે કાબીલ-કિતાબેં

ઇસ્લામ રીસાલા ન. ૧—ઇસમે ઈમાનવાલા કે અકીદે બયાન કીયે હે જીનકે બગેર ઈમાન કામીલ નહી હોતા, જીનકા જાનના હર મુસલમાન કો જરૂરી હય ઓર ગુજરાતમે જુબાન ગુજરાતી આમ હે ઓર અફસોસ ગુજરાતી જાનને વાલા ના અકાઇદમે વાકીફ કમ મકસુદ થા, ઇસ લીયે યહ રીસાલા ગુજરાતી હરફમે ઓર ઉરદુ જુબાનમે છપવાય હે આનેકી ટીકીટ ભેજકર મંગાવે કી ૦— —૬

ઇસ્લામી રીસાલા ન. ૨—ઉર્ફે તોહફતુલ મુસલેમીન યેહ રીસાલા હર મુસલમાન કે પાસ હોના જરૂરી હે ઇસ વાસતે કે ઇસમે પાકી નાપાકી, વાઝુ તયમમુમ ઓર નમાઝ કે હરએક અહકામ મુફસ્સલવાર બયાન હે યેહ રીસાલા મસઅલોકી મોઅતેબર કીતાબોસે લેકર લીખા હે ઇસલીયે યહ બડી કીતાબો કા કામ દેતા હે યેહ રીસાલા ભી જરૂરત કે લીયે ગુજરાતી હરફમે છપ ગયા હે સાડે તીન આનેકી ટીકીટ ભેજકર મંગાવે કીમત ૦—૩—૦

નમાઝકા ફલસફા ઉર્ફે-હમારી નમાઝ—ઇસ રીસાલેમે કુરઆન ઓર સરચા નીનાવો મે મુતઅસસીર તકરીર હમારી નમાઝકા ફલસફા દીલ ચસ્પ તરીકે ઓર નિહાયત ખુબીસે બયાન કીયા હે, કે બે નમાઝી ઇસકો પઢકર નમાઝ પઢને લગતે હે ઓર નમાઝી જીયાદા મજબુત ઓર પાબંદ હુવે હે

યેભી ગુજરાતી હરફોમે હે કી ૦—૪—૦
સાડે ચાર આનેકી ટીકીટ ભેજકર મંગાવે.

આર્ય ધર્મનું ખંડન અને ઇસ્લામનું મંડન—ગદેરના એક ફાઝિલ મોલવી સાહબનું લખેલું છે અને નુરે ઇસ્લામના વાચકો કેટલાક એ અંકોમાં વાચી ગયા છે. આર્ય ધર્મના લીધે કેટલી મુશકલીઓમાં માણસ પડી જાય છે અને દુન્યામાં નિર્લજ જીંદગી ગુજારે છે તેનું કોર્ટના કેસના રૂપમાં રસિક વર્ણન છે. નિયોગની ખરાબીઓ ખુલ્લી દેખાઇ આવે છે, માંસઆહાર વેદ અને દયાનંદી ગ્રંથોપરથી સાબિત કરે છે અને સ્વામી દયાનંદે સત્યાર્થ પ્રકાશ ગ્રંથમાં સમાવતીં ચલાવી છે તે તેઓ પોતેજ કલામોથી સાબિત કરે છે. રસિક હોવાને લીધે શરૂ કર્યા બાદ પુર્ણ કરતા પહેલા હાથથી છુટતીજ નથી. આ ચોપડીએ આર્ય સમાજીઓમાં ખળભળાટ નાખી દીધો છે. અનેક કોશીશો કર્યા છતા તેમનાથી એનો જવાબ બની શક્યો નથી. દરેક દીનદાર મુસલમાન ભાઇએ અવશ્ય ખરીદ કરીને પહેલા વાચવી અને પછી કોઇ હિન્દુ ભાઇબંધને વચાવવી જોઇએ. મુસલમાન ભાઇઓના ફક્ત લાભાર્થે છપાવેલા હોવાથી પેજ ૯૨ ઉપરાંત, કાગળ ઉંચા, ચનાઈ સફાઇદાર છતા કીમત ફક્ત રૂા [illegible] નાખી છે.

નુરે ઇસ્લામ ઑફીસ

મુફ્તીનીપોળ—**અમદાવાદ.**

ખસાએલ વ શમાએલ નબવી (સ. અ. વ. સ.)—આં હઝરત (સ. અ. વ. સ.)નું હુલ્યા મુબારક એટલે આપના માથા નાશીકથી લઈને કદમ શરીફ સુધીના પાક શરીર મુબારકનું બયાન અને હુઝુરના સ્વભાવ અખલાક, આદાબ ચાલચલન અને સદવર્તન કે જેણે નગાજનારા પ્રકૃતીના માણસોને અને અતિશય ઝગડાળુ આપસમાજ કાપી મરનારા ઇમાનના દુશમન જંગલી અરબોને આપના જાનનિસાર ગુલામ બનાવી દીધા માનસિક ફેરફારની ઉન્નતિ નપુર્ણ મહત્વભાનો નમુનો એના કરતા વધુ તો શું? પણ એના કરતા ઓછું પણ દુનિયામાં ભાગ્યેજ દેખાશે મુસલમાનોને આ પુસ્તક જરૂર વાંચવા જોઈએ જેથી ઇમાન તાજો અને પ્રેમ એ અફઝુના થાય છે એને માટે અમોએ ખાસ ઉંચા કાગળ અને સફાઈદાર છાપકામના બહાર પ્રગટ કરતા છે ચળકાર ટાઈટલવાળો દળદાર હોવા છતાં જુજ કીમત ફકત બાર આના રાખી છે માટે આશિકોને નમ્ર (સ. અ. વ. સ.) જલદી જલદી આના મોકલાવો કે, તૈયાર થએ જલદી મોકલી દેવાય

ઘણા અગત્યના પુસ્તકોનું લીસ્ટ એક પોસ્ટ કાર્ડ લખીને મફત મંગાવો

એક રૂપીઆની અઢારની ચોપડીઓ ટીકીટો મોકલીને મંગાવવી

નુરે ઇસ્લામ ઓફીસ.

સુદાગરાની પોળ—**અમદાવાદ.**

જાહેર ખબર.

ઇસ્લામની બેહેતરી ચાહનાર, સચ્ચાઈના મદદગાર વળીજ નમ્રતાથી અને ચોખવટથી આર્ય ધર્મનું ખંડન કરનાર, મુસલમાન ભાઇયોને મઝહબી, સામાજિક, ઇલ્મી અખલાકી શિક્ષણ અત્યંત સાદી ભાષામાં આપનાર અતિશય દિલપસંદ, મોજીલા અને ભાષાની ખુબી ધરાવનાર અગર વાચક વર્ગના મનને રંજન પમાડવા રજુ કરનાર ગજગત અસરો સાથે ઉર્દૂ અને ગુજરાતી ભાષામાં

નૂરે ઇસ્લામ

માસિક દરેક ઇસ્લામી મહીનાના પહેલા અઠવાડીયામા પ્રગટ થાય છે ઇસ્લામની દાઝ હૈયે ધરાવનાર દરેક મુસલમાને તરતજ ગ્રાહક થઈ, ઇસ્લામી માસિકને મદદ આપવા સાથે સત્યને દરેક દાખલ કરવા જોઇયે

કાગળ છપાઈ અને સુંદર ટાઈટલ પેજ પણ અતિ મનોહર અને ભપકાદાર છે

લવાજમ એક વર્ષ માટે

હિંદમાં રૂ. ૦-૮-૦   સિવાય પોસ્ટેજ ...

નમુનો રૂ. ૦-૫-૦

'નૂરે ઇસ્લામ' ઓફિસ - ... અમદાવાદ.